

# સંદર્ભ બુદ્ધિગ્રાહ્યતા માપક : ગુજરાતી

## Intelligibility in Context Scale (ICS): Gujarati

(McLeod, Harrison, & McCormack, 2012)

Translated by: Urvi Dave, NAATI accredited translator for Australian Multi Lingual Services, Australia, 2013

બાળકનું નામ: \_\_\_\_\_

બાળકની જન્મ તારીખ: \_\_\_\_\_ બાળકની જાતિ: \_\_\_\_\_

ભાષાઓ: \_\_\_\_\_

આજની તારીખ: \_\_\_\_\_ બાળકની ઉંમર: \_\_\_\_\_

ફરમ ભરનાર વ્યક્તિનું નામ: \_\_\_\_\_

બાળક સાથેનો સંબંધ: \_\_\_\_\_

નીચેના પ્રશ્નો તમારા બાળકની બોલીને જુદાં જુદાં લોકો કેટલું સમજી શકે છે તે બાબતમાં છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે પાછલાં એક મહિનાનો વિચાર કરશો. દરેક પ્રશ્ન માટે એક આંકડાંની ફરતે ગોળ દોરશો.

	હંમેશાં	મોટાભાગે	ક્યારેક	ભાગ્યેજ	ક્યારેય નહિં
1. તમે તમારાં બાળકને સમજે છો ?	5	4	3	2	1
2. તમારાં તરતનાં સગાં તમારાં બાળકને સમજે છે ?	5	4	3	2	1
3. તમારાં દૂરનાં સગાં તમારાં બાળકને સમજે છે ?	5	4	3	2	1
4. તમારાં બાળકનાં મિત્રો તમારાં બાળકને સમજે છે ?	5	4	3	2	1
5. બીજાં ઓળખીતાંઓ તમારાં બાળકને સમજે છે ?	5	4	3	2	1
6. તમારાં બાળકનાં શિક્ષકો તમારાં બાળકને સમજે છે ?	5	4	3	2	1
7. અજાણ્યાં લોકો તમારાં બાળકને સમજે છે ?	5	4	3	2	1
કુલ સંખ્યા =	/35				
સરેરાશ કુલ સંખ્યા =	/5				

<sup>1</sup> આ માપણીમાં બાળકને બદલે જીવનસાથી મૂકી તેને પુખ્તવયનાં વ્યક્તિની બોલવાની ક્ષમતાં માપવા માટે ઉપયોગમાં લઈ શકાય.

<sup>2</sup> અજાણ્યાં લોકોને બદલે ઓળખીતાં ન હોય તેવાં લોકો એવો શબ્દપ્રયોગ પણ કરી શકાય છે.

સંદર્ભ બુદ્ધિગ્રાહ્યતા માપકની આ આવૃત્તિની નકલ કરી શકાય છે. (This version of the Intelligibility in Context Scale can be copied.)

Intelligibility in Context Scale is licensed under a [Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License](https://creativecommons.org/licenses/by-nc-nd/3.0/).

McLeod, S., Harrison, L. J., & McCormack, J. (2012). The Intelligibility in Context Scale: Validity and reliability of a subjective rating measure. *Journal of Speech, Language, and Hearing Research*, 55(2), 648-656. <http://jslhr.asha.org/cgi/content/abstract/55/2/648>

